

ત્વરિત જાહેરાત માટે

તમે આના પર વિશ્વાસ કરો તો સાડ!

(You better BEElieve it!)

બ્રમ્પટન સત્તાવાર રીતે પ્રાપ્ત કરે છે બી સિટી (મધમાખીનું શહેર)નું પદ

બ્રમ્પટન, ઓન્ટારિયો (16 જૂન 2021) – બી સિટી કેનેડા દ્વારા બ્રમ્પટનને સત્તાવાર રીતે તેમના સૌથી નવીન બી સિટીનું બિરૂદ આપવામાં આવ્યું.

એક નામોલ્લેખિત બી સિટી તરીકે સીટી ઓફ બ્રમ્પટન મધમાખીઓ અને પતંગિયા સહિતના પરાગનયન કરતા કીટકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે. આમાં સામેલ છે હાલના પરાગનયન કરતા કીટકોના (પરાગ રજકો) રહેવાની જગ્યાઓનું સર્જન અને જાળવણી, રહેવાસીઓને પરાગનયન કરનાર કીટકો વિશે જાણકારી આપવી, અને આંતરરાષ્ટ્રીય પોલિનેટર વીક (જુન 21-27) દરમિયાન પરાગનયન કરનાર કીટકોને વધાવી લેવા.

બી સિટીનું બિરૂદ સિટી ઓફ બ્રમ્પટન માટે સિટીના કુદરતી વારસા પ્રણાલિને સુરક્ષિત રાખવા અને વધારવા માટે તેમના પ્રયાસોને બળ આપવા અને તેને પ્રોત્સાહિત કરવાની એક તક ગણી શકાય. સિટી ઓફ બ્રમ્પટન કેનેડા ફરનેની 50 સુધરાઈઓ સાથે જોડાય છે જેમણે આ બિરૂદ હાંસલ કર્યું છે.

બ્રમ્પટનના બી સિટીના બિરૂદને આ સંસ્થાઓનું સમર્થન પ્રાપ્ત છે [બ્રમ્પટન ગ્રો ગ્રીન ઈન્વાયરનમેન્ટલ માસ્ટર પ્લાન \(Brampton Grow Green Environmental Master Plan\)](#), [પાર્ક્સ એન્ડ રિક્રિએશન માસ્ટર પ્લાન \(Parks and Recreation Master Plan\)](#), [નેચરલ હેરિટેજ એન્ડ ઈન્વાયરનમેન્ટલ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી \(Natural Heritage and Environmental Management Strategy\) \(NHEMS\)](#) અને [બ્રમ્પટન ઈકો પાર્ક સ્ટ્રેટેજી \(Brampton Eco Park Strategy\)](#).

આંકડા શું કહે છે

- હાલમાં સિટી 17 સમર્પિત પોલિનેટર (પરાગનયન કરતા કીટકો) બેડ્સ અને 706 આખું વર્ષ ટકી રહેતા બેડ્સ જાળવે છે જે પરાગનયન કરતા કીટકોને મદદ કરે છે.
- 2002થી અત્યાર સુધી [બ્રમ્પટન વેલિ એન્ડ પાર્ક્સ નેચરલાઈઝેશન પ્રોગ્રામ \(Brampton Valley and Parks Naturalization Program\)](#) એ 220 હેક્ટર કરતા વધુ ભૂમિ કુદરતીકૃત કરી અને પરાગ રજકો માટે ખોરાક અને રહેઠાણ પૂરો પાડતા ઝાડવા અને વૃક્ષો અને મૂળ બીજના મિશ્રણનો ઉપયોગ કર્યો છે.
- 2018થી અત્યાર સુધી [ડોન્ટ મો, લેટ ઈટ ગ્રો પ્રોગ્રામ \(Don't Mow, Let it Grow Program\)](#) દ્વારા 21 હેક્ટર ટર્ફ ઘાસ ઘાસના મેદાન અને પરાગ રજક ઉદ્યાનોમાં રૂપાંતરિત થયા છે.

ઈન્ટરનેશનલ પોલિનેટર વીક (જુન 21-27)

જુન 21-27 પોલિનેટર સપ્તાહ છે! અમારી સાથે વર્ચ્યુઅલ માધ્યમ પર થતી પ્રવૃત્તિઓમાં જોડાઓ, જેમાં સમાવેશ થાય છે પોલિનેટરના થીમ ધરાવતા ટ્રેઝર હન્ટ જેમાં ઈનામો છે, ડાઉનલોડ કરી શકાય એવા રંગ ભરવા માટેના પાના છે, શોધ ચલાવી શકાય એવા સંસાધનો અને તથ્યો અને બીજું ઘણું બધું છે. વિગતો માટે www.brampton.ca/pollinators ની મુલાકાત લો.

બી સિટી કેનેડા વિષયક

જેની સ્થાપના 2016માં થઈ તે, [બી સિટી કેનેડા](#) એડરલ સરકાર દ્વારા સ્વીકૃત સખાવતી સંસ્થા છે જેમનું લક્ષ્ય કેનેડાવાસીઓને પરાગ રજકો વિશે જાણકારી આપવાનું છે કે પરાગ રજકોનું મહત્ત્વ શું છે અને પરાગ રજકોના રહેઠાણોની સુરક્ષા સુનિશ્ચિત થાય એવા પગલાં લેવા પ્રેરિત કરવાનું છે. સંસ્થા સમુદાયો અને એવી સંસ્થાઓ વચ્ચેના સહયોગને નીચે આપેલ ચાર પદ આપીને સમર્થન આપે છે જેઓ પરાગનયન રજકોને મદદરૂપ થવા પ્રતિબદ્ધ હોય. આ પદ નીચે મુજબના છે: બી સિટિઝ, બી પાર્ટનર્સ, બી સ્કૂલ્સ અને બી કંપ્સો.

સુવાક્યો

"અમને બી સિટી હોવાનું ગૌરવ છે! કેનેડામાં બ્રેમ્પટન સીટી એવી 50 પાલિકાઓ પૈકી એક છે જેઓ બી સિટીનું પદ હાંસલ કરી શક્યા છે અને અમે પરાગ રજકોને રક્ષણ આપવા અને મદદરૂપ થવા સમર્પિત છીએ જેથી આપણા અ સુદર શહેરમાં સ્વસ્થ અને વૈવિધ્યસભર ઈકોસિસ્ટમો જાળવી શકાય.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

સિટી ઓફ બ્રેમ્પટન આપણા સમુદાયોમાં પરાગ રજકોને રક્ષણ આપવાની મહત્તા બરાબર સમજે છે. અમારી પાસે પરાગ રજકોને સહાયરૂપ થવા અંગેના સંખ્યાબંધ પ્રોગ્રામ્સ અને પહેલો છે જેમાં સામેલ છે પોલિનેટર બેડ્સ બનાવીને તેને જાળવવા, કુદરતી સ્થળો ઊભા કરવા જેનાથી પરાગ રજકોને સહાયતા મળે. અમે બી સિટી કેનેડાનો આ સ્વીકૃતિ માટે આભાર માનીએ છીએ અને અમે પ્રતિબદ્ધતા મારફત અમારી પહેલોને આકાર આપીશું!"

- રોચેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટન

"દરેક જાણ બી સિટી પદને સહાયરૂપ થવામાં ભાગ ભજવે છે. પરાગ રજકો ખોરાક ઉત્પાદનમાં અને સ્વાસ્થ્યપ્રદ રહેઠાણો અને કુદરતી પ્રણાલિઓ જાળવવામાં અતિમહત્ત્વપૂર્ણ છે. હું રહેવાસીઓને દેશી વૃક્ષો અને પુષ્પો વાવવા, સ્થાનિક ખેડુતોને મદદરૂપ થવા તેમજ અહીંથી અમારી પહેલો વિશે વધુ જાણકારી મેળવવા આહવાહન આપું છું www.brampton.ca/pollinators."

- ડુગ વ્હિલાન્સ, સિટી કાઉન્સિલર, વોર્ડ 2 અને 6, સભ્ય, એનવાયર્નમેન્ટ એડવાયઝરી કમિટી; સભ્ય, CEERP કમ્યુનિટી ટાસ્ક ફોર્સ, સિટી ઓફ બ્રેમ્પટન

"સિટીના સ્ટાફ અમારા પ્રોગ્રામ્સ અને પહેલોને આગળ ધપાવવા માટે સમર્પિત છે જે બ્રેમ્પટનના બી સિટીના પદને સહાયરૂપ હોય. હું અમારા સહયોગીઓ અને ભાગીદારો સાથે કાર્ય કરવા ઉત્સુક છું જેથી આપણા સમુદાયોમાં મદદમાખી અને પતંગિયા જેવા પરાગ રજકોને મદદરૂપ થવાય અને તેમનું રક્ષણ કરી શકાય."

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સિટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca